

## પરીશિષ્ટ - ૬

### વર્તણુંક અને શિસ્તના નિયમો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ અનુસ્નાતક ભવનો - કેન્દ્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વર્તણુંક અને શિસ્તપાલનના નિયમો

1. વિદ્યાર્થીએ પ્રત્યેક સત્ર/ સેમેસ્ટરના પ્રારંભ દિનથી જ બધા જ કાર્યદિનોએ કોલેજમાં બધા જ શૈક્ષણિક વર્ગો, પ્રાયોગિક કાર્ય વગેરેમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. અનિવાર્ય સંજોગો કે માંદગીને કારણે હાજર રહી ન શકાય ત્યારે ડોક્ટરી પ્રમાણપત્ર કે જે સંજોગોમાં હાજર રહી શકાય તેમ ન હોય તેના કારણો સાથે જાણ કરવાની રહેશે.
2. વિદ્યાર્થીઓ વર્ગમાં કોઇપણ જાતનો વિક્ષેપ ઉભો કરશે નહિ તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અધ્યાપકગણનું અપમાન કરશે નહીં.
3. યુનિવર્સિટી કેમ્પસમાં કોઇપણ વિદ્યાર્થી કાયદા - વિરુદ્ધ કે સુલેહ શાંતિનો ભંગ કરી શકે નહીં.
4. કોઇપણ વ્યક્તિ કે સમુહ કે પક્ષથી યુનિવર્સિટીના નિયમિત સંચાલનમાં દખલ કરે તેવી કોઇપણ પ્રવૃત્તિ પ્રતિબંધિત છે. તેવી પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થી સામે શિસ્તભંગના પગલા ભારવામાં આવશે.
5. યુનિવર્સિટીની યુનિવર્સિટીના કર્મચારીગણની કે વિદ્યાર્થીગણની મિલ્કતને નુકશાન પહોંચાડવાની કે નાશ કરવાની મનાઇ છે. આવું થયેલ નુકશાન સંબંધિત વિદ્યાર્થીઓના માતાપિતા કે વાલી પાસેથી વસુલ કરવામાં આવશે.
6. વિદ્યાર્થી સમુહ કે વ્યક્તિગત વિદ્યાર્થી પાસેથી વ્યક્તિગત શિષ્ટાચાર અને યોગ્ય વર્તનની અને વિનયની અપેક્ષા રાખવામાં આવે છે.
7. અભ્યાસેતર પ્રવૃત્તિના સંચાલનમાં વિદ્યાર્થીએ પ્રમાણભાન જાળવવું પડશે અને તેઓ શૈક્ષણિક આવશ્યકતાઓમાં પોતાની જાતને દખલરૂપ નિવડવા દેશે નહીં.
8. અધ્યાપકગણ તરફથી વખતોવખત શૈક્ષણિક કે અન્ય કાર્યને લગતી અપાતી સુચનાઓને યુસ્તપણે પાળવી આવશ્યક રહેશે.
9. શિષ્ય-શિક્ષક સંબંધોને કે શૈક્ષણિક ધોરણોને નુકશાન પહોંચાડે તેવી અને યુનિવર્સિટીએ સત્તાવાર રીતે માન્ય ન કરી હોય તેવી કોઇપણ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે નહિ.
10. યુનિવર્સિટીના સત્તાવાળાઓ તરફથી અપાયેલ ઓળખપત્ર દરેક વિદ્યાર્થીએ પોતાની પાસે રાખવાનું રહેશે અને સંસ્થાના અધિકૃત અધિકારી જ્યારે તપાસવા માગે ત્યારે રજૂ કરવાનું રહેશે.
11. કોઇપણ વિદ્યાર્થી પોતાની પાસે કેફી અથવા માદક દ્રવ્યો રાખી શકશે નહીં અને તેનું સેવન કરશે નહીં ગેરકાયદેસર હથિયાર રાખી શકાશે નહિ અને જો આ સુચનાનું ઉલ્લંઘન કરશે તો તેનો પ્રવેશ રદ કરવામાં આવશે.

જ્યારે જ્યારે વર્તન (યાવયલગત) અંગેના ઉપર નિર્દિષ્ટ સામાન્ય ધોરણો કે અન્ય ખાસ ધોરણો અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ વખતો વખત અપનાવે તે ધોરણો પાળવામાં વિદ્યાર્થી કસુરવાર થશે તો તે માટે કુલપતિશ્રી દ્વારા દંડ તથા ખાસ કિસ્સામાં અભ્યાસ મોકુફી કે બરતરફી જેવા શિક્ષાત્મક પગલાં લઇ શકશે અને તે માટે કુલપતિશ્રી સક્ષમ અધિકારી ગણાશે અને તેમનો નિર્ણય બંધનકર્તા રહેશે.